Surbhi Industries Limited



Regd. Office 'Surbhi House', F. P. No. 206, 2nd Floor, B/h. Old Sub Jail, Khatodara, Ring Road, Surat - 395002 Gujarat, India. **GSTIN** : 24 AADCS 4385 E 1ZF **PAN No.** : AADCS 4385 E

Date: 26.05.2023

To The Manager **Bombay Stock Exchange Limited,** The Corporate Relationship Department, 14th Floor, New Trading Ring, Rotunda Building, Phiroze Jeejeebhoy Tower, Dalal Street Fort, Mumbai - 400 001

Sub. - : Publication of Newspaper Advertisement – Audited Financial Results for the Quarter and year ended on 31st March, 2023.

Ref. -: Scrip Code - 514260

Dear Sir / Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, we have published the newspaper advertisements for the above mentioned results in western times (English) and Western Times (Gujarati) on 26/05/2023. Please find attached extracts of audited financial results for your kind perusal.

Kindly take the same on your records and acknowledge the receipt.

Thanking you, Yours faithfully,

FOR, SURBHI INDUSTRIES LIMITED

RAVJIBHAI P. PATEL MANAGING DIRECTOR DIN: 00023332

Encl: As above

વેસ્ટર્ન ટાઇમ્સ

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative. Venue : Radisson Blu, Panchvati Cross Road,

Ellisbridge, Ahmedabad 380007 Date: 28th May, 2023 Time: 10,30 a.m.

Contact Person: Pravin Sumesara (9898018526) Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow. All Covid protocols will be followed.

We look forward to your participation.



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor, Senapati Bapat Marg, Elphinstone (West) Mumbai - 400013

> Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

> > રૂા.લાખમાં ઈપીએસ સિવ

ક્વાર્ટર સમાપ્ત વર્ષના અંતે

ગર્લફ્રેન્ડની ચાકુ મારી હત્યા પથ્થર કાપવાના મશીનથી મૃતદેહના ટૂકડા કરી ફિજમાં છૂપાંવ્યા

આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ચંદ્રમોહને અનુરાધાનો પીછો

પોલિથીનમાં એક મહિલાની ટૂકડા છોડાવવા માટે તેની હત્યા કરવાનું (એજન્સી)નવી દિલ્હી, કરેલી લાશ મળી આવી હતી. આ કાવતરુ રચ્યું હતું. ૧૨ મેના રોજ્ હેદરાંબાદમાં દિલ્હીના જાણીતાં પછી તેણે પોલીસને જાણ કરી હતી. શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના બની તમામ તપાસ બાદ પોલીસે મૃતક મહિલાની ઓળખ યેરમ અનુરાધા રેક્રી તરીકે કરી હતી. અનુરાધા પપ વર્ષની હતી. તેના અને ૪૮ વર્ષીય ચંદ્ર મોહન વચ્ચે ૧૫ વર્ષથી અફેર હતું. અનુરાધાના પતિએ તેને ઘણા સમય પહેલા છોડી દીધી હતી, તેથી તે ચંદ્ર મોહનના ઘરે રહેતી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે અનુરાધા વ્યાજ પર પૈસા આપતી હતી. ચંદ્ર મોહને ૨૦૧૮માં અનુરાધા પાસેથી ૭ લાખ રૂપિયા પણ લીધા હતા. અનુરાધા ચંદ્ર મોહનને પૈસા પરત કરવાનું કહેતી હતી પરંતુ ચંદ્ર મોહન પૈસા પરત

વાસ્તવમાં ૧૭ મેના રોજ સુધાકર નામના કર્મચારીને

છે. અહીં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે બે પથ્થર કાપવાના મશીન ખરીદ્યા હતા. તેણે ગર્લફ્રેન્ડના મૃતદેહના ટૂકડા કરી માથું કાપી નાખ્યું અને તેને પોલિથીનમાં ભરીને ક્રીજમાં રાખ્યું હતુ. થોડા દિવસો બાદ તેણે લાશને કચરાના ઢગલા પાસે ફેંકી દીધી હતી. આ પછી તેણે ઘર સાફ કર્યું જેથી કોઈ પુરાવા મળે નહીં. એટલું જ નહીં, તે મૃતક મહિલાના ફોન પરથી તેના પરિંચિતોને મેસેજ કરતો રહ્યો જેથી લોકોને લાગે કે તે જીવિત છે. પોલીસે વ્યક્તિની ધરપકડ કરી કરતો ન હતો. આવી સ્થિતિમાં અનુરાધા તેના પર પૈસા પરત કરવા માર્ટે સતત દબાણ કરી રહી હતી.

થિયાગલગુડા રોડ પર કચરો ડમ્પિંગ સાઇટ પરથી કાળા રંગની

	અમદાવાદ સ્ટુનિસિપલ કોર્પોરેશન કેન્દ્રલ સ્ટોર્સ, વમાલપુર દરવાજા બ્રહાર, અમદાવાદ-૩૮૦૦૦૧ શોર્ટ ટેન્ડર નોદિસ નં૧ & ૮/૨૦૧૩-૨૪ ટેલી નં.૦૯૮-૨૫૩૯૦૭૩૦/૨૫૩૯૬૭૧૩		7 आज़ादी _क अमृत महोत्सव				
ા.૨૪/૦૫/૨૦૨૩ આ.મ્યુ.કો.ના સેન્ટ્રલ સ્ટોર્સ ખાતા મારફતે નીચે જણાવેલ આઇટમો માટે ટેન્ડર મંગાવવામાં આવે છે. રસ ધરાવતા ટેન્ડરર તથા સપ્લાયરોએ ટેન્ડર નીચે જણાવેલ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી ભરવાના રહેશે.							
टेन्डर	સી.એસ.ટી	આઈટમની વિગત	અંદાજીત ખર્ચ	વેબસાઈટ			

ટન્ડર	સી.એસ.ટી	આઇટમની વિગત	અંદાજીત ખર્ચ	વંબસાઇટ
નોટિસ નં.	નં.			
१/२०२उ-२४	9	જી.ટી.મશીનના સળિયા	૧૧,૬૫,૦૦૦/-	www.nprocure.com
શોર્ટ ઈ-ટેન્ડર				
(ટુ-બીડ ટેન્ડર)				
८/२०२३-२४	૫૦	Supply For F.R.P. Catchpit Cover Along With Frames 35T	४,९६,०००/-	www.nprocure.com
શોર્ટ ઈ-ટેન્ડર		as per AMC tender tems & conditions		
(ટુ-બીડ ટેન્ડર)				
			•	•

ડે.મ્યુનિ કમિશનર/ઓ.એસ.ડી (સેન્ટ્રલ સ્ટોર્સ)

INDO CREDIT CAPITAL LIMITED

CIN: L65910GJ1993PLC020651

Regd.Off.:304, Kaling, B/h. Bata Show Room, Nr. Mt. Carmel School, Ashram Road, Ahmedabad 380009 www.indocreditcapital.com email: indocredit@rediffmail.com Tele Fax: 079-26580366

Extract of Audited Financial Results for the

Quarter and Year ended 31st March, 2023

				(Rs. In Lacs
Sr No.	PARTICULARS	Quarter Ended 31/03/2023 (Audited)	Year Ended 31/03/2023 (Audited)	Quarter Ended 31/03/2022 (Audited)
1	Total income from operations (net)	4.23	4.23	3.27
2	Net Profit / (Loss) for the period (Before Tax & Exceptional items)	-1.10	-17.36	2.59
3	Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)	-1.10	-17.36	2.59
4	Net Profit / (Loss) for the period (After Tax & Exceptional items)	-1.10	-17.36	2.59
5	Total comprehensive income for the period	-1.10	-17.36	2.59
6	Equity Share Capital	723.08	723.08	723.08
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of previous year	-131.28 (As on 31-03-2023)	-131.28 (As on 31-03-2023)	-113.92 (As on 31-03-2022)
8	Earnings Per Share (of Rs.10/- each) Basic: (Rs.) Diluted (Rs.)	(-)0.02 (-)0.02	(-)0.24 (-)0.24	0.04 0.04

૩૧મી માર્ચ ૨૦૨૩ ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને વર્ષના ઓડિટેડ નાંણાકીય પરિણામો ક્વાર્ટર સમાપ્ત વર્ષના અંતે ຕາມປ

બ્લુ ચિપ ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

CIN : L17100DN1985PLC005561 રજી ઓફિસ : પ્લોટ નં. ૬ ૩-બી, દાનુયુગ સહકારી સંઘ લી. ગામ પીપરીયા, સીલવાસા, યુ.ટી. દાદરા અને નગર હવેલી-૩૯૬૨૩૦, કોર્પોરેટ ઓફીસ : ઓફીસ નંબર-૧૫/૧૭, પહેલો માળ, મેકર ચેમ્બર્સ ૩, જમનાલાલ બજાજ રોડ, નરીમન પોઈન્ટ, મુંબઈ-૪૦૦૦૨૧. છમેછલ આછડી : bluechiptex@gmail.com, વેબસાઇટ : www.bluechiptexindustrieslimited.com ટેલીફોન ન. ૦૨૨૪૩પ૩૦૪૦૦

ไดงเต	૩૧.૦૩.૨૦૨૩ ઓડીટેડ	૩૧.૦૩.૨૦૨૩ ઓડીટેડ	૩૧.૦૩.૨૦૨૨ ઓડીટેડ	૩૧.૦૩.૨૦૨૨ ઓડીટેડ
કામગીરીમાંથી કુલ આવક	૫,૮૮૨.૮૯	૨૫,૨૭૨.૪૦	૬,૧૯૦.૫૮	૨૪,૩૦૮.૨૫
ચોખ્ખો નફો / (નુકસાન) કર બાદ	ह.८७	૯૧.૨૦	પ૧.૫૧	૩૨૧.૭૫
સમયગાળા માટે કુલ વ્યાપક આવક	૧૦.૨૭	૯૩.૩૦	४५.६८	392.23
ઇક્વિટી શેરની મૂડી	૧૯૭.૦૫	૧૯૭.૦૫	૧૯૭.૦૫	૧૯૭.૦૫
અન્ય ઇક્વિટી	-	ર,પ૭૫.૬૨	-	ર,૫૪૧.૪૩
શેર દીઠ આવક (પ્રત્યેક રૂ.૧૦ /-ની મૂળ કિંમત)				
મૂળભૂત અને પાતળું	૦.૩૫	४.६३	૨.૬૧	૧૬.૩૩
કમિટી દ્વારા કરવામાં આવી છે અને ૨૫મી મે, ૨૦૨૩ના આવેલ છે. 2. ઉપરોક્ત સેબી (લિસ્ટિંગ ઓબલિકેશન્સ એન્ડ ડિસ્ક્લાઝર રિક ફાઈલ કરવામાં આવેલા ઓડિટેડ નાણાકીય પરિણામોનું વિ એ ક્સચે ઇન્જ વે બસાઈટસ www.bsc www.bluechiptexindustrieslimited પર	વાયરમેન્ટ)નિયમ સ્તૃત સ્વરૂપ છે. sindia.co	ાન, ૨૦૧૫ ની નિય સંપૂર્ણ ત્રિમાસિક ન	મન ૩૩ હેઠળ સ્ટ ાણાકીય પરિણામ કંપનીની	ોક એક્સચેન્જમાં ોનું ફોર્મેટ સ્ટોક વેબસાઇટ
થ્થળ : મુંબઇ તારીખ : ૨૫ મે, ૨૦૨૩				ઓફ ડાચરેક્ટર વતી સહી/-, શાહીન એન. ખેમાની મેનેજીંગ ડાચરેક્ટર

ચંદ્રમોહન અને અનુરાધા વચ્ચે

પૈસાને લઈને બીજી વખત ઝઘડો

થયો હતો. દરમિયાન ચંદ્રમોહને

અનુરાધા પર ચાકુ વડે હુમલો કર્યો

હર્તા. આ હુમલામાં તેનું મોત થયું

હતું. અનુરાધાની હત્યા કર્યા પછી

ચંદ્રમોહને મૃતદેહનો નિકાલ

કરવાની યોજના બનાવી. આ માટે

તેણે પહેલા પથ્થર કાપવાના બે

મશીન ખરીદ્યા હતા. આ મશીનની

મદદથી પહેલા તેણે અનુરાધાનું માથુ

અલગ કરી દીધું.

ANNEXURE I

Surbhi Industries Limited

CIN NO. L17110GJ1992PLC017672 Reg. : "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail, Ring Road,

Khatodara, SURAT GUJARAT 395002

Extract of Audited Financial Results for the

Quarter and Year Ended on March 31, 2023

					•	nt. in lacs
	Particulars		EE MONTHS		ENDED	
	Fatticulars	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.202
	Total Income from Operations	741.78	428.55	877.76	2708.65	2861.00
	Net Profit / (Loss) for the period					
	(before Tax, Exceptional and/or					
	Extraordinary items)	7.42	-187.42	-607.93	8.92	194.26
	Net Profit / (Loss) for the period					
	before tax (after Exceptional items					
	and/or Extraordinary items)	7.42	-187.42	-607.93	8.92	194.26
	Net Profit / (Loss) for the period					
	after tax (after Exceptional and/or					
	Extraordinary items)	7.42	-187.42	-565.57	8.92	111.29
	Total Comprehensive Income for the					
	period [Comprising Profit/(Loss)					
	for the period (after tax) and Other	7 40	407.40		0.00	440.00
6	Comprehensive Income (after tax)]	7.42	-187.42	-565.57	8.92	112.88
	Equity Share Capital Reserves (excluding Revaluation	34374000	34374000	34374000	34374000	34374000
	Reserve) as shown in the Audited					
	Balance Sheet of the previous year			1358.17		
	Earnings Per Share (of Rs. 10/- each)			1336.17		
	(for continuing and discontinued					
	operations) -					
	1) Basic:	0.22	-5.45	-1.65	0.26	3.28
	2) Diluted:	0.00	0.00	0.00	0.00	0.00
	z) Dildted.	0.00	0.00	0.00	0.00	0.00

ગંગાએ રચ્ચો ઇતિહાસ ગાચ માતાની વિવિધ જાત મેળવવામાં ભારત બની શકે ગેમ ચેન્જર ઇતિહાસ રચ્યો હતો, પરંતુ કરવામાં આવ્યો અને આ ટેકનિકનો

ફેફસાંમાં સંક્રમણને કારણે પ દિવસ

બાદ આ બચ્ચાનું મોત થયું હતું. જે

બાદ ભારતે અન્ય ૨૬ જાનવરોના

ક્લોન તૈયાર કર્યા, જેમાં ગાયના

ક્લોનિંગમાં સૌથી વધુ સમય લાગ્યો

છે. ગાય પ્રત્યે ધાર્મિક સંવેદનશીલતા

હોવાને કારણે તેમાં વધુ સમય

લાગ્યો હતો. NDRIના પૂર્વ

ડાયરેક્ટર ડૉ. એમએસ ચૌહાણે

જણાવ્યું કે, ભેંસ માટે કતલખાના

સાથે સંપર્ક કરી શકીએ છીએ અને

ઓઓસીટ પ્રાપ્ત કરી શકીએ છીએ,

પરંતુ ગાય માટે આ પ્રકારે ન કરી

(એજન્સી)નવી દિલ્હી,

અમદાવાદ

વિશ્વમાં જે પણ જીવ જન્મ લે છે. તે વિશેષ જ હોય છે. આ વર્ષે ૧૬ માર્ચના રોજ જન્મેલ વાછરડી 'ગંગા' નો જન્મ ખૂબ જ ખાસ છે. 'ગંગા' ભારતમાં ગાયની પહેલી ક્લોન છે. હરિયાણાના કરનાલમાં 'ગંગા'નો જન્મ થયો છે, જે માટે રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, ક્લોનિંગથી દેશી ગાયના પ્રજનનને પ્રોત્સાહન મળશે. ક્રોસ બ્રીડિંગ, ઉચ્ચ ઉપજવાળી નસ્લ અને નિકાસ અપનાવવાને કારણે આ સંખ્યા ઓછી થઈ ગઈ હતી. 'ગંગા' ગીર ગાયની પ્રજાતિ છે, જે દેશની ગરમ અને આર્દ્ર જળવાયુને અનુકૂળ છે. ક્લોનિંગ ટેકનિકથી દેશમાં વધુ દૂધ આપનાર પશુઓની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક ડૉ. હિમાંશુ પાઠકે જણાવ્યું છે કે, જન્મ સમયે 'ગંગા'નું વજન ૩૨ કિલો હતું. તે શારીરિક, આનુવંશિક અને અન્ય પરીક્ષણમાં સફળ રહી છે. પરંતુ આ સ્તર સુધી પહોંચવામાં વૈજ્ઞાનિકોને અનેક વર્ષોનો સમય લાગ્યો છે. ફેબ્રુઆરી ૨૦૦૯મા ICAR અને NDRIએ દુનિયાના પ્રથમ ક્લોન કોઈ નુકશાન થતું નથી. થોડા સમય

મુંબઈએ લખનો સુપર જાયન્ટ્સને ૮૧ રને પરાજય આપ્યો

કેમેરોન ગ્રીનની શાનદાર બેટિંગ બાદ આકાશ માધવાલની ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે મુકાબલામાં લખનૌ સુપર જોયન્ટ્સને ૮૧ રને પરાજય આપ્યો હતો. આ સાથે જ લખનૌની ટીમ આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩માંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે મુંબઈ હવે ફાઈનલમાં પહોંચવાં માટે શુક્રવારે બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ટકરાશે. પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાતનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે પરાજય થયો હતો ર્જે ૧૦મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૮૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં ગ્રીને સૌથી વધુ ૪૧ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં લખનૌની ટીમ ૧૬.૩ ઓવરમાં

ઈન્કમટેક્ષ બાર એસોસિએશનના હોદ્દેદારો નીમાચા



ભેંસના બચ્ચાં સમરૂપાને લઈને સુધી આ ટેકનિંક પર અભ્યાસ (એજન્સી)નવી દિલ્હી, ૧૦૧ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશ માધવાલે ૩.૩ ઓવરમાં ફક્ત પાંચ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. એલિમિનેટર લખનૌ સુપર જાયન્ટ્સ સામે ૧૮૩ રનનો લંક્ષ્યાંક હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સે ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું જેની સામે લખનૌના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. આકાશ[ົ]માધવાલની ઝંઝાવાતી બોલિંગ સામે લખનૌના બેટર્સ કંઈ કમાલ કરી શક્યા ન હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રેરક માંકડ ત્રણ અને કેપ્ટન કુણાલ પંડ્યા આઠ ૨ન નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે કાયલે માયર્સ

પણ ૧૮ રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. માર્ક્સ સ્ટોઈનિસે એક છેડો જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ૨૭ બોલમાં ૪૦ રન નોંધાવીને રન આઉટ થઈ ગયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી

હતી. આયુષ બદોની એક જ રન નોંધાવી શક્યો હતો જ્યારે નિકોલસ પૂરન ખાતું પણ ખોલાવી શક્યો ન હેતો અને પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. દીપક હૂડાએ ૧૫, ગૌતમ બે તથા રવિ બિશ્રોઈએ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે આકાશ માધવાલે ૩.૩ ઓવરમાં ફક્ત પાંચ રન આપીને

<u>ઓપન 'ઈ' ટેન્ડર નોટીસ</u>

ઓએચઇ મોડિફિકેશન

મારતના રાષ્ટ્રપતિ વતી અને માટે ડિવિઝનલ રેલ

મેનેજર (ઈલેક્ટ્રિકલ ટીઆર.ડી) પશ્ચિમ રેલવે પ્રતાપનગર, વડોદરા-39004 દ્વારા નીચેના કામ

માટે ટેન્ડર્સ આમંત્રિત કરવામાં આવે છે. **ક્રમ. સં.** ટેન્ડર નં. અને કામનું નામઃ EL/TRD/Tender

23-24/02 R વડોદરો ડિવિઝનના સુરત-ગેરતપુર અને વડોદરા-ગોધરા સેક્શનમાં સ્ટેશનના બિ્નઆવરીત વિસ્તાર ઉપર ક્વરશેડની જોગવાઇ

ભિનઆવરીત વિસ્તાર ઉપર કવરશેડની જોગવાઈ અને સ્ટીલ ગાઈડરના બદલીકરણના સંબંધમાં ઓએચઇ પોડિકિશન કરવાનું કામ. કામની અંદાજીત પડાર (* માં) દી, 73,058 જમા કરાવવાની બીડ સિક્ચોરીટી (* માં): 1,23,500/- ટેન્ડર દસ્તાવેજની પડતર અને પૂર્ણતાનો સમયગાળો : વિના મૂલ્યે. પૂર્ણતાનો સમયગાળો 12 મહિના, વેન્ડર શેડ્યૂલ : ટેન્ડર બંધ થવાની તારીખ 26.06.2023 અને ટેન્ડર બંધ થવાની તારીખ 26.06.2023 અને ટેન્ડર બંધ થવાનો સમય એ જ તારીખે. 15.00 કલાકે.

વેબ પેજ વિગતો અને નોટીસ બોર્ડનું સ્થળ જ્યાંથ

સંપૂર્ણ વિગતો જોઈ શકાશે અને ઓકિસનું સરનામુ અને સ્પષ્ટીકરણઃ વેબસાઈટ @<u>www.ireps.gov.in</u> ડિવિઝનલ્ટ્રેલવે મેનેજર (ઈલેક્ટ્રિકલ ટીઆરડી),

(EL/TRD/Tender/23-24/02 R dtd.

अमने सा85 इरोः 📑 facebook.com/WesternRly

લેસ્ટર્ન ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ

પોતાની રીતે ચકાસણી કરી

નિર્ણય લેવો.

રેલવે, પ્રતાપનગર,

22.05.2023)

नं.: EL/TRD/Tender/23-24/02 ह

શકાય. વર્ષ ૨૦૧૮માં વૈજ્ઞાનિકોએ કર્યો છે કે, ટેકનિકની વૃદ્ધિ કરવામાં ઓવમ પિક-અપ (ઓપીયૂ) નામના આવશે અને વધુ વાછરડાના ક્લોન બિન-ઈનવેસિવ ટેકનિક વિશે બનાવવામાં આવશે. ભારતમાં જાણકારી મળી હતી. જેના વ્યાવસાયિક ક્લોનિંગનો માર્ગ ઉપયોગથી ગાયને કોઈ પણ પ્રકારનું મોકળો કરવા માટે વૈજ્ઞાનિક નુક્શાન થતું નથી અને ઓસાઈટ્સ નીતિગત રજૂઆત પણ કરવામાં આવશે. ગીર, સાહીવાલ અને રેડ અલગ કાર્ય વિના પ્રક્રિયા કરી શકાય છે. ચૌહાણે જણાવ્યું કે, જેમ ગાયનું સિંધી મુખ્યરૂપે સૌથી વધુ દૂધ રજિસ્ટ્રેશન કરવામાં આવે તો આપતા જાનવર છે. ગાયના કાન પર મુક્કો મારીને ચેક

ઉપયોગ કર્યા પહેલાં મંજરી માટે

અરજી કરવામાં આવી. જે બાદ વર્ષ

૨૦૨૧માં 'ગંગા' ક્લોન કરવાનો

પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ક્લોનિંગ માટે

વૈજ્ઞાનિક ઓસાઈટના ડીએનએની

સંરચના બદલે છે અને ત્યાર પછી

ભ્રૂણમાં પરિપક્વ કરે છે. જેનાથી

નિર્ધારિત થાય છે કે, જાનવરમાં કયા

ગુણ હશે. અમારો ઉદ્દેશ્ય માત્ર

એટલો જ છે કે, આ વાછરડા કઠિન

જળવાય પરિસ્થિતિનો સામનો

કરવા માટે પણ સક્ષમ હોય અને વધુ

દૂધ આપનાર હોય. NDRIએ દાવો

કરીએ છીએ, તેં જ રીતે આ ટેકનિકનો ઉપયોગ કરીને કોશિકાઓ કાઢવામાં આવે છે. NDRIના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નરેશ સેલોકર જણાવે છે કે, જાનવરને અ.મ્યુ.કે

અમદાવાદ,

હતી.

ટેન્ડર

ઈન્કમટેક્ષ બાર એસોસીએશન અમદાવાદની તા.૨૫.૫.૨૦૨૩ના રોજ મળેલ ૭૬મી વાર્ષિક સામાન્ય સભામાં નીચે મુજબના હોદ્દેદારો તથા કારોબારી સઁભ્યોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે. પ્રેસિડેન્ટ એમરેટસ ઃ એડવોકેટ ધીરેશ ટી. શાહ , ઓફિસ બેરર્સ ઃ પ્રમુખ ઃ સી.એ. આશિષ ટી. ટેકવાણી, ઉપપ્રમખ : સી.એ. શ્રીધર કે. શાહ, માનદુ મંત્રી : સી.એ. જયકિશન પી. પેમનાની, માનદ્ સહમંત્રી ઃ સી.એ. મૌલિક બી. પટેલ, ખજાનચી : સી.એ. શિવમ કે. ભાવસાર

મેનેજિંગ કમિટિના સભ્યો : ભાવેક કે. ગોવાણી , હિરેન સી. ઠક્કર, સી.એ. કેતન એમ. સત્યવાદી, નરેન્દ્ર ડી. કરકર, સી.એ. પાર્થ એચ. દોશી, પાર્થ કે. કથીરિયા, સી.એ. પ્રતીક પી. કનેરીયા, સી.એ. સુવ્રત એસ. શાહ

નામ બદલેલ છે મેં મારું નામ ખુમાણ રામચંદ્રરાજ લક્ષ્મણભાઈ હતું, જે બદલીને જૈન રામચંદ્રરાજ લક્ષ્મણભાઈ કરેલ છે. જેની નોંધ લેવી. **સરનામું :** શેઢવાડા, M.R.C.T.C ઉના, જુનાગઢ 936

	936	-જાહેરખબર	મેનેજર		the period (after Comprehensive
				6	Equity Share Ca
	પશ્ચિમ રેલવે-ભાવ	નગર ડિવિઝન		7	Reserves (exclu
	વિવિધ એન્જિન્	નેયરીંગ કામ			Reserve) as sho
नं. W/118/NIT/E-Te	nder/2023-24/WA/03 તાર્ર		ાંફિસ. ભાવનગર		Balance Sheet of
પરા વિષય : ઈ-ટેન્ડર નં	. 13/2023-24 થી 16/202	23-24 ટેન્ડરની વિગતો નીચે પ્રમાણે	.છે.	8	Earnings Per Sh
ક્રમ નં. ઈ-ટેન્ડર સંખ્યા		અંદાજીત રકમ (₹)		1.	Basic:
01 13/2023-24	ગ્રુપ કામઃ (1) એડીઇએન-પ	પોરબંદર સબ ₹ 2,22,52,429.35	₹ 2,61,300.00	2.	Diluted:
જોગવાઈ (2) એડીઇએ સિસ્ટમ, રોડ સપાટી, પ 85 ખાતે ડ્રેનેજ સિસ્ટમ 02 14/2023-24 ડીઆરએમ ઓફિસ અ 03 15/2023-24 અધિકારક્ષેત્ર: એલએચ 205એક્સ, 210 ચ આસપાસના વિસ્તાર ખ	ોન-પોરબંદર સબ ડિવિઝન: એલ્ ગથીયાં વગરેની સુધારણા (3) એ અને પ્રતિધારક દિવાલ, રોડ સપારં વિાવવ ગર પરા: ભાવનગર તે રેલવે હોસ્પિટલની સુધારણા ગ સિનિ. ડીઇએન (સમ.) બેસના (ધોળા જં ભાવનગર સે નો વિશ્હોર પાલીતાણા સંકશન ાતે વરસાદી પાણી/કાદવ/ગારો બ	: પરા ખાતે ₹68,72,031.92 બને નવીનીકરણ કરવાનું કામ. ભાવનગરનું ₹4,21,921.02 હશન ઉપર એલસી/એલએચએસ નં. ઉપર એલસી/એલએચએસ નં. હશર કાઢવા માટે ડિઝલ પમ્પ ભાડે કર	14 ખાતે ડ્રેનેજ બેલએચએસ નં. [₹ 1,37,500.00 [₹ 8,400.00 . 192, 197, 4, 13, 25) વાનું કામ.	1 2 3 4	TE : The above Result at their meetings result. The Auditors have 31.03.2023 as ref unmodified Audit F Operations of the The figures for co
એલસી નં. 205એક્સ ભાવનગર ટર્મિનસ-ધ એલએચએસ નં. 04 પાલીતાણા વગેરે માં એ ઉપરોક્ત બધા ટેન્ડરો ગ 12.06.2023 છે www.ireps.gov.in	માં ડ્રેનેજ વ્યવસ્થા, પ્રતિધારક તેળા જ, માં એલએચએસ ને માં ડ્રેનેજ વ્યવસ્થા અને સમ લએચએસ નં. 13, 25 માં ડ્રેને તાટે: બીડીંગ શરૂ થવાની તારીખ . એનઆઈટી તારીખ 15 . અનેઆઈટી તારીખ 19 . પર અપલોડ કરવામાં આવી છે.	પર સેક્શન - [₹2,40,91,434.94 દિવાલ, સમ્પની સુધારણા (2) ભ ા. 197 માં અને શિહોર-પાલી પની સુધારણા (3) ભાવનગર પર જ વ્યવસ્થા અને સમ્પની સુધારણા. બા : 29.05.2023 બીઠીંગ બંધ થ છ.05.2023ના રોજ રેલવે અથબે કોરો કરો: ⊉ twitter.com	ાવનગર પરા - તાણા વગેરેમાં રા - શિહોર- થવાની તારીખ : ની વેબસાઈટ 18	Pla	Figures for standa financial results, a published year to nce: Ahmedabad te: 24.05.2023

Note: પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ 1. The aforesaid results of the Company were reviewed by the Audit Committee and જોર્ડન અને પિયુષ ચાવલાને એકapproved by the Board of Directors at its meeting held on 25th May, 2023. એક સફળતા મળી હતી. મંબઈ 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial results ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે. Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual તેની શરૂઆત નિરાશાજનક રહી Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com and on company's website www.indocreditcapital.com 3 Previous year's figures have been regrouped/rearranged whereever necessary. પશ્ચિમ રેલવે-વડોદરા ડિવિઝન

For and On Behalf of the Board of Directors

INDO CREDIT CAPITAL LIMITED Ramkaran M. Saini Director (DIN: 00439446)

Date : 25/05/2023 Place : Ahmedabad

ADVANCE MULTITECH LTD.

(CIN:L51494GJ1979PLC006698)

Regd.Off.: 36,Kothari Market, Opp. Hirabhai Market, Kankaria, Ahmedabad 380022, Website : www.advancemulti.com

Phone: +91 8758998855 | Fax: +91 79-25454586 | E-mail: jinfo@advancemulti.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

			Quarter end	Year ended		
	Particulars	31-03-2023 Audited	31-12-2022 Unaudited	31-03-2022 Audited	31-03-2023 Audited	31-03-2022 Audited
1	Total Income from Operations	791.26	315.94	564.11	1,607.27	1,048.90
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or				- 10 10	
	Extraordinary items)	495.64	122.54	64.39	743.12	7.14
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	495.64	122.54	64.39	743.12	7.14
4	Net Profit / (Loss) for the period after	495.04	122.04	04.33	745.12	7.14
4	tax (after Exceptional and/or					
	Extraordinary items)	493.06	122.54	66.40	740.54	9.15
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other					
	Comprehensive Income (after tax)]	493.06	122.54	66.40	740.54	9.15
6	Equity Share Capital	402.86	402.86	402.86	402.86	402.86
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited					
	Balance Sheet of the previous year	-	-	-	1,238.79	498.25
8	Earnings Per Share (of Rs. 10/- each)	(Not	(Not	(Not		
_		Annualised)	Annualised)	Annualised)	(Annualised)	r ,
1.	Basic:	12.24	3.04	1.65	18.38	0.23
2.	Diluted:	12.24	3.04	1.65	18.38	0.23

The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held on 24/05/2023. The statutory auditor of the Company have reviewed the said result.

- The Auditors have carried out audit of the financials for the quarter and for the financial year ended on 31.03.2023 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and the related unmodified Audit Report on the same forwarded to the Stock.
- Operations of the Company falls under single reportable Segment
- The figures for corresponding previous periods have been regrouped/ rearranged wherever necessary.
- Figures for standalone financial results for the quarter ended 31st, March 2023 as reported in these financial results, are the balancing figures between audited figures in respect of full financial year and published year to date figures upto the end of the third quarter of the financial year.

For, Advance Multitech Limited (Arvind Goenka) (Managing Director (DIN-00093200)

ADVANCE PETROCHEMICALS LTD

(CIN L23200GJ1985PLC008013)

Regd.Off.: 36,Kothari Market, Opp. Hirabhai Market, Kankaria, Ahmedabad 380022, Website : www.advancepetro.com Phone: +91 8758998855 | Fax: +91 79-25454586 | E-mail: info@advancepetro.com"

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

	Quarter ended					r ended
	Particulars	31-03-2023 Audited	31-12-2022 Unaudited	31-03-2022 Audited	31-03-2023 Audited	31-03-202 Audited
1	Total Income from Operations	794.02	1,006.34	830.00	3,718.08	2,802.46
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	(40.40)	41.45	44.00	404 50	40.50
3	Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(49.12)	41.45	11.89	131.58	43.56
1	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(41.27)	31.45	3.89	94.43	29.56
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(41.27)	31.45	3.89	94.43	29.50
3	Equity Share Capital	90.00	90.00	90.00	90.00	90.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	252.26	157.82
3	Earnings Per Share (of Rs. 10/- each)	(Not Annualised)	(Not Annualised)	(Not Annualised)	(Annualised)	(Annualised
	1. Basic:	(4.59)	3.49	0.43	10.49	3.28
	2. Diluted:	(4.59)	3.49	0.43	10.49	3.28

NOTE :

Place: Ahmedabad

Date: 24.05.2023

The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held on 24/05/2023. The statutory auditor of the Company have reviewed the said result.

- The Auditors have carried out audit of the financials for the quarter and for the financial year ended on 31.03.2023 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and the related unmodified Audit Report on the same forwarded to the Stock.
- Operations of the Company falls under single reportable Segment
- The figures for corresponding previous periods have been regrouped/ rearranged wherever necessary.
- Figures for standalone financial results for the quarter ended 31st, March 2023 as reported in these financial results, are the balancing figures between audited figures in respect of full financial year and published year to date figures upto the end of the third quarter of the financial year.

For, Advance Petrochemicals Limited (Pulkit Goenka) (Managing Director) (DIN-00177230)

Do In Lakho avaant EDS

Susiness

Western Times AHMEDABAD FRIDAY 26/5/2023

Direct Amul not to procure milk in TN: Stalin to Amit Shah

which has been nurtured in

true cooperative spirit over

private diaries in the state

competing with Aavin,

Stalin said the move by

Amul will create unhealthy

competition between coop-

eratives engaged in procur-

ing and marketing milk and

have been the bedrock of

dairy development in the

Power Minister highlights sector reforms,

challenges at CII Annual Session

ambitious plan to further

bring down losses to less

than 15 per cent by the next

year, demonstrating a com-

mitment to achieving

greater efficiency and finan-cial stability within the

of politicization in the

power sector over the

years, Singh expressed

Addressing the issue

power sector.

"Regional cooperatives

milk products.

Even as there are several

decades," Stalin said.

Chennai, May 25 (IANS) Tamil Nadu Chief Minister M.K.Stalin on Thursday said the Kaira District Cooperative Milk Producers' Union or Amul is infringing on the milk-shed area of Tamil

Nadu Cooperative Milk Producers Federation Limited or Aavin Stalin, in a letter to Union

Home Minister Amit Shah, urged him to direct Amul not to procure milk from Aavin's milk-shed area.

Stalin referred to Amul setting up of chilling centres and a processing plant in Krishnagiri District and its plans to procure milk in and around Dharmapuri, Venore, Tirupathur, and Krishnagiri, Kancheepuram and Tiruvallur districts in the state.

"It has been a norm in

New Delhi, May 25

(IANS) The Centre on Thurs-

day said that significant im-provements have been

made in the power sector,

and efforts made to address

the viability concerns faced

by power distribution com-

panies (discoms) and the

nual Session 2023 being

held here, Raj Kumar Singh, the Union Minister of Power,

New and Renewable Energy

stated, "We have taken on

challenges that would have

deterred you, one of them

being viability. We have ef-

tackled."

Speaking at the CII An-

broader industry issues.

India to let cooperatives states and they are better thrive without infringing on each other's milk-shed area. Such cross-procurement goes against the spirit of Operation White Flood' and will exacerbate problems for the consumers given the prevailing milk shortage scenario in the country. This act of AMUL infringes on Aavin's milk- shed area

placed to engage and nurture producers and to cushion consumers from arbitrary price hikes," Stalin said.

Meanwhile, former Union Minister and PMK leader Anbumani Ramadoss said Amul is setting up a processing plant at SriCity in Andhra Pradesh and targets to procure about 30,000 litres of milk daily in Tamil Nadu.

The PMK leader said Aavin's market share in Tamil Nadu is only 16 per cent and it will go down further if Amul enters the milk market in the state.

Ramadoss said Amul is procuring milk at a price of about Rs 36 per litre whereas Aavin is paying about Rs 32-34/litre. Aavin should increase its milk procurement price.

concern over

sighted politicians who

promise free electricity to

gain votes". He empha-

sized that there is no such

thing as free power, as it ultimately burdens tax-

payers who pay the bill.

offering freebies and free

power increases the vul-

nerability of the sector.

He said the practice of

quired a 100 per cent stake in FinFort Infotech,a digital credit analytics company for retail seg-ment. As part of the acqui-

sition, for which terms were not disclosed, FinFort will join the Yubi group of companies, collaborating with Yubi's subsidiary, Corpository. FinFort offers advanced tech infrastructure and data analytics for private data to banks and NBFCs. With this move, Yubi said it will further solidify its position as a key

(IANS) Unified credit

marketplace digital plat-form Yubi on Thursday

announced that it has ac-

Germany fails into recession

Berlin, May 25 (IANS) Germany has fallen into recession after high prices took a bigger toll on the

countrys economy than originally anticipated, offi-cial data revealed on Thurs-

day. The data by Germany's federal statistical office showed gross domestic product (GDP) fell by 0.3 per peacefully today at the age of 83 aftér a long illness in cent in the first quarter comher home in Kusnacht near pared with the previous Zurich, Switzerland. With her, three months, which also the world loses a music legrecorded a contraction, reend and a role model," her ports the Guardian. representative said in a

New Delhi, May 25 try while expanding its prod- joined FinFort Ir joined FinFort Infotech LLP uct suite and enhancing its caas designated partners."By pabilities. "This acquisition leveraging our experience, aligns with our mission of beproducts, technology, and ing the ubiquitous layer, a uniindustry connections at fied credit infrastructure that Yubi and Corpository, we deepens the debt markets. will guide FinFort toward FinFort's deep knowledge of transitioning from a product-based company that digital credit analytics, coupled with Corpository's strengths, addresses specific chalwill enable us to provide comlenges to a platformprehensive solutions and serbased company that ofvices to our customers," said fers holistic solutions," said Shah, who will now lead FinFort along with its existing leadership team. Yubi has facilitated debt volumes of over Rs 1,40,000 crore with more than 17,000 enterprises and over 6,200 investors and lenders on its platform.

Rock 'N' Roll Legend, 'Private Dancer' hitmaker Tina Turner dies at 83

Los Angeles, May 25 statement to 'Variety'. (IANS) Soulful diva Tina Turner, who had a lengthy run of '60s and '70s R&B hits and struck major pop star-dom in the '80s, died on Wednesday in Switzerland, reports'Variety'. She was 83. 'Tina Turner, the 'Queen of Rock 'n' Roll' has died

Business Brief

Reliance Consumer completes acquistion of 51% stake in Lotus Chocolates

Mumbai, Further to the media release dated December 29, 2022, regarding acquisition of controlling stake in Lotus Chocolate Company Limited ("LOTUS"), Reliance Consumer Products Limited ("RCPL"), the FMCG arm and a wholly-owned subsidiary of Reli-ance Retail Ventures Limited (RRVL) has – Completed the acquisition of 51% controlling stake in LOTUS for an aggregate consideration of Rs. 74 crore. Subscribed to non-cumulative redeemable preference shares of LOTUS for an aggregate consideration of Rs. 25 crore.

UP to have new authority to develop waterways

Lucknow, May 25 (IANS) Uttar Pradesh will now have a dedicated body to oversee the development of new waterways. Chief Minister Yogi Adityanath has announced the setting up of a new authority that would explore options of waterways and also work out policies to provide cheaper options of transport to give a boost to the micro small and medium en-terprises (MSMEs) in the state.

Reliance Retail generates net new employment for 2,500 people

New Delhi, May 25 (IANS) Reliance Retail generated net new employment for 2,500 people from January 2023 alone. As per market sources, 567 people resigned on performance grounds and serving noticeperiod post April 2023. Drumming up 567 performance-based exits which is less than 0.14 per cent) on a huge base of 400,000 plus is naive and alarmist, market sources said. Churn in all organised retail companies in India is 30-40 per cent annually. Separation is part of the normal course and is performance-related. Likewise, redeployment too is part of ongoing business process, sources said. Reliance has 400,000 plus people in its Retail business.

(Amt. in lacs)

EOGEPL partners with M/s Sensia for digitalization and remote operations in oil and gas fields

"short-

fectively taken care of this New Delhi, May 25 (IANS) issue by not only addressing Essar Oil and Gas Exploration current dues but also clearand Production Ltd (EOGEPL), ing legacy dues. Current India's pioneering unconvendues are being paid promptly, ensuring the viability problems have been He went on to highlight the transformative measures undertaken in the secthrough the deployment of tor, resulting in a significant Sensia's Avalon digital plat-

reduction in discom losses form interface. from 22 per cent to 17 per This strategic partnership cent. Furthermore, Singh reaims to unify measurement vealed the government's systems, optimize decisionmaking, and enable remote control of critical parameters across EOGEPL's wells, facili-WESTERN RAILWAY-VADODARA DIVISIO

Sensia's Avalon platform offers a comprehensive interface that simplifies the capture, analysis, and digitization of well-related activities, facility-related activities, and customer end operations. The

systems, optimize decisionmaking, and remotely control critical parameters across our operations.

significant progress in the realtime monitoring of the existing wells (BU-1 scope) and is currently in the process of monitoring an additional 200 wells (BU-2 scope). The automation solution integrated

investing another Rs 2,000 into the work program will crore for drilling 200 more contribute to the overall digiwells in the next 18 to 24 talization efforts, enabling remote operations and improvmonths. The company is employing the latest technology ing efficiency for production in the existing wells to ramp expansion plans in BU-2. The up production from 0.9 collaboration between EOGEPL and Sensia presents mmscd to 1.3 mmscd. Under the contractual partnership numerous benefits to the oil with Sensia, EOGEPL has made and gas industry. By utilizing a single interface for capturing and monitoring all essential parameters, the digitalization efforts will drive increased well performance, leading to enhanced production and reduced operating costs.

IAMAI rejigs top team with Indian CEOs after outcry over pro-Big Tech views

MakeMyTrip, and Satyan from the present councils at Ganjwani, Vice Chairman, the upcoming annual gen-Times Internet, have been eral meeting, the associaelected as Vice Chairman tion announced. and the Treasurer, respec-

Earlier this month, sev-

More than a decade after her crossover hit 'Proud Mary' with husband Ike, Tina Turner ascended to the pinnacle of pop fame with the 1984 Capitol Records album 'Private Dancer'. The collection, which spawned a trio of top-10 pop hits, sold five million copies and garnered four Grammy Awards, adds 'Variety'. Though she never matched that breakthrough solo success, she recorded and toured profitably until her retirement in 2000.

Surbhi Industries Limited CIN NO. L17110GJ1992PLC017672 Reg. : "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail, Ring Road. Khatodara, SURAT GUJARAT 395002 Extract of Audited Financial Results for the

Quarter and Year Ended on March 31, 2023

ANNEXURE I

					•	
		THR	EE MONTHS	ENDED	YEAF	ENDED
	Particulars	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022
1	Total Income from Operations	741.78	428.55	877.76	2708.65	2861.00
2	Net Profit / (Loss) for the period					
	(before Tax, Exceptional and/or					
	Extraordinary items)	7.42	-187.42	-607.93	8.92	194.26
3	Net Profit / (Loss) for the period					
	before tax (after Exceptional items					
	and/or Extraordinary items)	7.42	-187.42	-607.93	8.92	194.26
4	Net Profit / (Loss) for the period					
	after tax (after Exceptional and/or					
	Extraordinary items)	7.42	-187.42	-565.57	8.92	111.29
5	Total Comprehensive Income for the					
	period [Comprising Profit/(Loss)					
	for the period (after tax) and Other					
_	Comprehensive Income (after tax)]	7.42	-187.42	-565.57	8.92	112.88
6	Equity Share Capital	34374000	34374000	34374000	34374000	34374000
7	Reserves (excluding Revaluation					
	Reserve) as shown in the Audited					
	Balance Sheet of the previous year			1358.17		
8	Earnings Per Share (of Rs. 10/- each)					
	(for continuing and discontinued					
	operations) -					
	1) Basic:	0.22	-5.45	-1.65	0.26	3.28
	2) Diluted:	0.00	0.00	0.00	0.00	0.00

tional hydrocarbon (Coal Bed Methane) player, Thursday announced its collaboration with Sensia, a leading provider of digitalization solutions, to enhance operations

ties, and customer interface. PROVISION OF 10 KVA AUXILIARY TRANSFORMER & CABLING ACTIVITY

(IANS) After facing an outcry from the Indian startup ecoplatform enables real-time system for promoting views data acquisition of essential that are "anti-Indian and

"By leveraging advanced technologies, we are confident that we will achieve increased production, reduced operating costs, and enhanced efficiency, reaffirming our commitment to sustainable and efficient energy production."EOGEPL has already invested Rs 5,000 crore in exploration in the Raniganj

block in drilling 350 wells. The company is further looking at

New Delhi, May 25

addition, Kumar and Aniket player in the credit indus-Shah, CEO of Corpository,

Gaurav Kumar, Founder and CEO of Yubi. Corpository is a SaaS-based credit analytics platform for corporate lending, providing access to over 100 public information sources, including MCA, court records, tribunals, and more. In

Yubi acquires digital credit analytics

locking of level crossing gates in Anand-Godhra-Vadodara section of Vadodara Division. Approximate cost of the work (in ₹) : 43,52,506/- Bid Security to be deposited (in ₹) : 87,100/- Cost of Tender document and completion period : Free of cost. Completion period 09 nonths. Tender scheduled on : Tende closing date 20.06.2023 and time of Closing at 15.00 hrs. on the same date. Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification: Website @ **www.ireps.gov.in** Divisional Railwa Manager (Electrical Tr.D) Wester Railway, Pratapnagar, Vadodara (Electrical H.D) Western Pratapnagar, Vadodara-(EL/TRD/Tender/23-24/10 Itd. 19.05.2023) Like us on: f facebook.com/WesternRly

OPEN 'E' TENDER NOTICE

Tender No. EL/TRD/Tender/23-24/10 Tenders for and on behalf of The Presiden

of India are invited by Divisional Railway

of India are Invited by Divisional RaliWay Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004 for the following works. Sr. No. 1 Tender No. & Name of Work: EL/TRD/Tender/ 23-24/10 Provision of 10 KVA Auxiliary

Transformer and cabling activity for inter

WESTERN RAILWAY-VADODARA DIVISION

Sr. No. 1 Tender No. & Name of Work

DRM-BRC 048 of 2023-24. Vadodara

Division :- Need base repair of existing

hand pumps for one year and providing δ

fixing of new hand pumps at requirect locations under the jurisdiction of Assistant Divisional Engineer- Godhra

and Assistant Divisional Enginee

North-Vadodara. (Re- invited)(R-1

Approximate cost of the work (in ₹) 10,17,471.29 Bid Security to b deposited (in ₹) : 20,400.00 Sr. No.

Tender No. & Name of Work: DRM-BRC

Supply of Rubble/Stone boulders an quarry dust in stacks at Dakor an

Chandod railway Station. (Re-invited

(R-1). Approximate cost of the work (in

(₹): 38,45,040.00 Bid Security to be deposited (in ₹): 76,900.00 For Both Above Tenders: Date and time for

submission of tender and opening o

tender : Tender is to be submitted of

09.06.2023 before 15.00 Hrs., and is t

be opened on same date at 15.30 Hrs Website particulars and notice for

location where complete details

can be seen & Address of the

office from where the tender form can be purchased: Website @

www.ireps.gov.in Divisional Railway Manager (WA/C), Western Railway, Pratapnagar, Vadodara-4. W/623/NIT of 2023-24 dated 19.05.2023 51

Like us on: f facebook.com/WesternRly

049 of 2023-24. Vadodara Division

ENGINEERING DEPARTMENT "E" TENDER NOTICE VARIOUS ENGINEERING WORK -Tender Notice No. DRM-BRC 048 (049 of 2023-24. Sealed Tenders for and on behalf of the President of India are invited by Divisional Railway Manage to unify our measurement (WA/C), Western Railway, Pratapnaga Vadodara-390004 for the following works

parameters, such as mechanical, electrical, gas and water flow, pressure, and power backup device data, among others.

With remote access and control capabilities, EOGEPL gains the ability to monitor and adjust critical well and facility parameters, facilitating efficient operations and proactive decision-making. Commenting on the de-

velopment Pankaj Kalra, CEO of EOGEPL said, "We are delighted with our collaboration

with Sensia and the deployment of their Avalon digital platform interface. This partnership represents a significant milestone in our digitalization journey, as it enables us

pro-foreign Big Tech", the Internet and Mobile Association of India (IAMAI) on Thursday announced a new leadership that has founders and CEOs from homegrown startups and unicorns.

Harsh Jain, Co-founder, and CEO of Dream Sports has been elected the Chairman of the association. He replaces Sanjay

Particulars

Total Income from Operations

Net Profit / (Loss) for the period

(before Tax, Exceptional and/or

Net Profit / (Loss) for the period

tax (after Exceptional and/or

before tax (after Exceptional and/or

Net Profit / (Loss) for the period after

Total Comprehensive Income for the

period [Comprising Profit / (Loss) for

the period (after tax) and Other

Comprehensive Income (after tax)

Reserves (excluding Revaluation

Reserve) as shown in the Audited

Balance Sheet of the previous year

Earnings Per Share (of Rs. 10/- each)

unmodified Audit Report on the same forwarded to the Stock.

Operations of the Company falls under single reportable Segment

Extraordinary items)

Extraordinary items)

Extraordinary items)

Equity Share Capital

1. Basic 2. Diluted

result.

Place: Ahmedabad

Date: 24.05.2023

NOTE :

Gupta, Vice President and Country Manager, Google India.

Rajesh Magow, Co-Founder and Group CEO,

tively Magow

replaces Shivnath Thukral, Director and Head of India Public Policy, Meta and Ganjwani replaces Harshil Mathur, CEO and Co-Founder at Razorpay.

The new team members will form the association's executive council along with the ex-officio member Dr Subho Ray, President, IAMAI.

ADVANCE MULTITECH LTD.

(CIN:L51494GJ1979PLC006698)

Regd.Off.: 36,Kothari Market, Opp. Hirabhai Market, Kankaria, Ahmedabad 380022.

Website : www.advancemulti.com

Phone: +91 8758998855 | Fax: +91 79-25454586 | E-mail: jinfo@advancemulti.com

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH. 2023

31-03-2023

Audited

791.26

495.64

495.64

493.06

493.06

402.86

(Not

alised)

12.24

12.24

The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors

at their meetings held on 24/05/2023. The statutory auditor of the Company have reviewed the said

The Auditors have carried out audit of the financials for the quarter and for the financial year ended on

31.03.2023 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and the related

The figures for corresponding previous periods have been regrouped/ rearranged wherever necessary.

Figures for standalone financial results for the quarter ended 31st, March 2023 as reported in these

financial results, are the balancing figures between audited figures in respect of full financial year and

published year to date figures upto the end of the third quarter of the financial year.

The new 24-member Governing Council and the Tech's anti-competitive new Executive Council of the IAMAI will take charge practices.

Quarter ended

Unaudited

315.94

122.54

122.54

122.54

122.54

402.86

(Not

alised)

3.04

3.04

31-12-2022 31-03-2022

Audited

564.11

64.39

64.39

66.40

66.40

402.86

(Not

alised)

1.65

1.65

eral founders and CEOs of Indian startups and unicorns slammed the IAMAI. saying it was sad to see an organisation originally founded by and for Indian companies being taken over by Big Tech representatives. The IAMAI has members who are the top Indian heads of Big Tech firms like Google, Microsoft, Meta and others. The association also prepared a draft submission on whether India needs a separate law to tame Big

Rs. In Lakhs except EPS

Audited

743.12

743.12

740.54

740.54

402.86

1,238.79

nnualised

For, Advance Multitech Limited

(Arvind Goenka)

(DIN-00093200)

(Managing Director

18.38

18.38

Year ended

Audited

7.14

7.14

9.15

9.15

402.86

498.25

nualised

0.23

0.23

31-03-2023 31-03-2022

1,607.27 1,048.90

NOTE a) The above results were reviewed by the Audit Committee and thereafter taken on record by the Board in its meeting held on May 25,2023 and also Audit Report were carried out by the Statutory Auditors. b) The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (https://www.surbhi.com/investor-relations). The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote. # - Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable. For, Surbhi Industries Limited (Managing Director Sd/ Place: Surat Ravjibhai Parbatbhai Patel (DIN: 00023332) Date: 25.05.2023

ADVANCE PETROCHEMICALS LTD

(CIN L23200GJ1985PLC008013)

Regd.Off.: 36,Kothari Market, Opp. Hirabhai Market, Kankaria, Ahmedabad 380022, Website : www.advancepetro.com

Phone: +91 8758998855 | Fax: +91 79-25454586 | E-mail: info@advancepetro.com"

STATEMENT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023

			Quarter end	ed	Year ended		
	Particulars	31-03-2023 Audited	31-12-2022 Unaudited	31-03-2022 Audited	31-03-2023 Audited	31-03-2022 Audited	
-	Total Income from Operations	794.02	1,006.34	830.00	3,718.08	2,802.46	
(Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(49.12)	41.45	11.89	131.58	43.56	
	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(49.12)	41.45	11.89	131.58	43.56	
. 	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(41.27)	31.45	3.89	94.43	29.56	
l	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(41.27)	31.45	3.89	94.43	29.56	
	Equity Share Capital	90.00	90.00	90.00	90.00	90.00	
	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	252.26	157.82	
	Earnings Per Share (of Rs. 10/- each)	(Not	(Not	(Not			
		Annualised)	Annualised)	Annualised)	(Annualised)	(Annualised)	
	1. Basic:	(4.59)	3.49	0.43	10.49	3.28	
	2. Diluted:	(4.59)	3.49	0.43	10.49	3.28	

NOTE

Place: Ahmedabad

Date: 24.05.2023

The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held on 24/05/2023. The statutory auditor of the Company have reviewed the said result.

The Auditors have carried out audit of the financials for the quarter and for the financial year ended on 31.03.2023 as required under Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and the related unmodified Audit Report on the same forwarded to the Stock.

- Operations of the Company falls under single reportable Segment
- The figures for corresponding previous periods have been regrouped/ rearranged wherever necessary.
- Figures for standalone financial results for the quarter ended 31st, March 2023 as reported in these financial results, are the balancing figures between audited figures in respect of full financial year and published year to date figures upto the end of the third quarter of the financial year.

For, Advance Petrochemicals Limited (Pulkit Goenka) (Managing Director) (DIN-00177230)

WESTERN RAILWAY-VADODARA DIVISION **OPEN 'E' TENDER NOTICE OHE MODIFICATION**

India are invited by Divisional Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004 for the following works. Sr. No. 1 Tender No. 8 following works. Sr. No. 1 Tender No. & Name of Work: EL/TRD/Tender/ 23-24/02 R OHE modification work in connection with replacement of steel girder and provision o cover shed over uncovered area of station in Surat - Geratpur and Vadodara - Godhra section of Vadodara division. Approximate cost of the work (in ₹) : 61,73,058/- Bid Security to be dep osited (in ₹): 1,23,500/-Cost of Tender document and completion period : Free of cost. Completion period 12 months. Tender scheduled on : Tender closing date 26.06.2023 and time of Closing at 15.00 hrs. on the same date. Web page particulars and notice for location where complete details can be seen & address of the office and clarification Website @ www.ireps.gov.in Divisiona Railway Manager (Electrical Tr.D) Western Railway, Pratapnagar, Vadodara-390004. (EL/TRD/Tender/23-24/02 R dtd. 22.05.2023)

Ρ

Property on plot no. 86 land 110.57.50 sq.mts of N. A. sur. no. 2259 (old sur. no. 166 paikee) i. e. Property Idar Nagar Palika no. 2/369/1008/85 area known as " Gayatari Nagar " situated at Idar, Ta. Idar, Dist. Sabarkantha on name of Raval Bharatbhai Manilal. The said property purchased by him by register sale deed sr. no. 1322 dt. 07/09/1989 and registered at SRO - Idar. The said sale deed been lost or misplaced. We hereby invited claims or objection (in writing) for issuance certificated copy of sale deed within the period of 7 (Seven) day from the publication of this notice. If no claims/objections are received during this period, We shall be free to sale, mortgage or case may be.

Date:25/05/2023 M. J. Doshi (advocate) (M) 9998090948 Address: 2, Viral Complex, Idar-Khedbrahma Highway Road, At. & Po. Idar, Dist. Sabarkantha

Tender No. EL/TRD/Tender/23-24/02 R Tenders for and on behalf of The President o Like us on: facebook.com/WesternRly

Ш	RI	IC	NO	TIC	F
		.10	NO		

Ahmedabad, Page 7